

## ફાર્મ યાર્ડ મેન્યુઅલ બનાવવા માધ્યમનો ઉપયોગ

માધ્યમ કયાં અને કેવીરીતે વપરવું :

અ. અર્ધ કોહવાયેલ છાણીયા ખાતરની ઉથરેટી (ઉકરડો અથવા ખેતર માંથી નીકળેલ કચુર) માં....

જ્યારે ઉથરેટી એક જગ્યાએથી બીજી જગ્યાએ દેરવવાની હોય અથવા તેના પર ટાસ (મોરમ)નાખવાના સમયે એક ટન (ટ્રેક્ટરની એક ટ્રોલી)ખાતર સાથે એક કિલોગ્રામ માધ્યમ પોઠ લીટર પાણીમાં મીશ કરી છંટકાવ કરવો.

બ. સુકી સાંઠી (કપાસ, એરંડા, તુવેર બાજરી વગેરે) તલનાં તલસરા, ઘઉનું કુવળ. દરેક પ્રકારના ઓર્ગનિક, ઘરગઢું અને ખેતરનો બગાડ, વગેરે

### માધ્યમ ના ઉપયોગથી ફાર્મ યાર્ડ મેન્યુઅલ બનાવવા ના પગથીયા

પગલું ૧ : સૌપ્રથમ સુકી સાંઠીને કટર દ્વારા બને ત્યાં સુધી જાણો ભુકો કરવો આ ઉપરાંત ઘઉના કુવળ, શાકભાજના નકામા કચરાને પણ સાંઠીના જાણો ભુકામાં મિશ્ર કરવો.

પગલું ૨ : આ પ્રમાણે તૈયાર થયેલા પોઠ મણ (૧ ટન) કચરામાં ૧ કિલોગ્રામ માધ્યમ પાવડરની જરૂરત પડશે આ ૧ કિલોગ્રામ માધ્યમને પોઠ લીટર પાણીમાં ઓગાળી દ્વારા બનાવો.

પગલું ૩ : આ તૈયાર થયેલ ફૂચાનું, (કચરાના ભૂકાનું) અડધા થી પોણા ફૂટ ઉચાઈ તથા બાર થી પંદર ફૂટ લંબાઈનું પ્રથમ સ્તર કરો અને જરૂરીયાત પુરતો ભેજ (૪૦-૫૦%) તે પ્રમાણે કુચાને પાણી વડે પલાણો. આ પ્રમાણે ઢગલાને ગોઠવવાથી સેન્ટ્રિયકરણની પ્રક્રિયા જરૂરી બને છે.

પગલું ૪ : ત્યારબાદ તૈયાર કરેલ માધ્યમનાં દ્વારાવણનો અડધો જથ્થો (૨૫ લિટર) આ પ્રથમ સ્તર ઉપર છંટાવો. બેકટેરીયાને ખોરાક મળે તે માટે પોઠ કિલોગ્રામ છાણાની રબડી પણ છાંટો.

પગલું ૫ : આ પ્રમાણે બે થી ત્રણ સ્તર કરવા, ઢગલો પ ફૂટથી વધુ ના રાખવો. ઢગલામાં ભેજનું પ્રમાણ ૪૦ ટકા સુધી જાળવી રાખવા નિયમિત જોતા રહેવું અને જરૂરજાણાય તે પ્રમાણે ૧૦-૧૨ દિવસે પાણીનો છંટકાવ કરવો.

પગલું ૬ : વીસ થી પચ્ચીસ દિવસ બાદ ઢગલાને ફેરવી નાખવો. તે દરમ્યાન જો, તાપમાન ૫૦ સેલ્વિસયસથી વધે નહીં, તો ફેરવતી વખતે વાપરેલી માત્રાથી અડધી માત્રામાં (૫૦૦ગ્રા) માધ્યમનો ફરીથી ઉપયોગ કરવો.

પગલું ૭ : સામાન્ય સ્થિતિમાં સેન્ટ્રિયકરણની પ્રક્રિયા ૮૦-૯૦ દિવસમાં પૂરી થઈ ભરભરુ અને સરસ રીતે કોહવાયેલું ખાતર તૈયાર થઈ જશે. તૈયાર થયેલ ખાતરને ઠંડી અને સુકી જગ્યામાં સંગ્રહ કરો.

### માધ્યમ વાપરવાના ફાયદા:

- ❖ પેથોજન્સ, દુર્ગધ, મુંડા, ઉઘાઈ અને નિંદામણનાં બીયારણ મુક્ત સેન્ટ્રિય ખાતર બનાવે છે.
- ❖ બેતીમાં કચરાનું સંતુલિત સેન્ટ્રિય ખાતરમાં જરૂરી રૂપાંતર કરે છે.
- ❖ જમીનમાં ફળદૂપતા વધારે છે.
- ❖ ખેતરમાં તાત્કાલિક ઉપયોગ કરી શકાય છે.
- ❖ કિમતમાં સસ્તુ અને વાપરવામાં સરળ છે.
- ❖ જમીનમામ પોષકતત્વો અને ખનીજોને જાળવી રાખે છે.
- ❖ જમીનમા નાખેલા રાસાયણિક ખાતરનો મહત્તમ ઉપયોગ થાય છે.



શ્રીકૃષ્ણ આઉન્ઝેન ટ્રસ્ટ વોદ્દરા સંચાલિત  
વિવેકાનંદ સેન્ટર ફોર એશ્રીકલ્યરલ સર્વિસીસ છોટાઉંડેપુ